

“કૃષિ ઈજનેરીના વોકેશનલ કોર્ષના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ”

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આ.કૃ.યુ, ગોધરા ખાતે વર્ષ ૨૦૧૨ થી વોકેશનલ કોર્ષ ઓન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી સુચારુ રીતે ચાલી રહ્યો છે. તારીખ ૦૭/૧૦/૨૦૧૫ ને બુધવાર ના દિવસે, આ કોર્ષ અંતર્ગત વર્ષ ૨૦૧૫ (ત્રીજો બેચ) માં સફળતા પૂર્વક ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સન્માન આપવા તથા તેમને પ્રમાણપત્ર વિતરણ કરવા માટે ડૉ. કે. બી કથીરિયા, સંશોધન નિયામકશ્રી અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષ આ.કૃ.યુ, આણંદ ની અધ્યક્ષતામાં તથા ડૉ. એમ. એન બ્રમભટ્ટ, કુલસચિવશ્રી, આ.કૃ.યુ, આણંદ અને ડૉ. ડી. સી. જોષી, વિદ્યાશાખાધ્યક્ષશ્રી, કૃષિ ઈજનેરી વિદ્યાશાખા, આ.કૃ.યુ, આણંદની પ્રમુખ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ ઉપરાંત ડૉ. એસ. એચ. અકબરી, વિદ્યાર્થી કલ્યાણ નિયામકશ્રી, આ.કૃ.યુ, આણંદ, ડૉ. એસ. એમ. ખાનોરકાર, સંશોધન વૈજ્ઞાનિકશ્રી, મુખ્ય મકાઈ સંશોધન કેંદ્ર, ગોધરા, ડૉ. પી. આર. વૈષ્ણવ, પ્રાધ્યાપક અને વડાશ્રી, આંકડાશાસ્ત્ર વિભાગ, આ.કૃ.યુ, આણંદ, શ્રી એમ. જી. વસાવા, કંપટ્રોલર, આ.કૃ.યુ, આણંદ અને ડૉ. એમ. એમ. ત્રિવેદી, આચાર્યશ્રી, કૃષિ ઈજનેરી પોલિટેકનિક, આ.કૃ.યુ, દાહોદ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. એમ. એલ. ગૌર, આચાર્યશ્રી, કૃ.ઈ.ટે.કો, ગોધરા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી વોકેશનલ કોર્ષની પ્રગતિ વિશે જાણકારી આપી અને આ વર્ષે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓની જૈન ઇરિગેશન સિસ્ટમ લિ. ઔદ્યોગિક એકમમાં તાલીમ તથા રોજગારી માટે પસંદગી થઈ ગયેલ છે તેમ જણાવવામાં આવ્યું. નવા વિદ્યાર્થીઓને પણ પ્રેરણારૂપ આ વક્તવ્યને સભાખંડમાં હાજર કૃ.ઈ.ટે.કો, ગોધરાના તમામ કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા તાળીઓના ગળગળાટ દ્વારા વધાવી લેવામાં આવ્યું.

આ કાર્યક્રમના પ્રાસંગિક ઉદબોધનમાં ડૉ. કે.બી. કથીરિયા સાહેબે વિદ્યાર્થીઓને વોકેશનલ કોર્ષના ફાયદાઓ અને ગ્રામીણ યુવાનો માટે આ કોર્ષનું કેટલું મહત્વ છે, તે સરળ ભાષામાં સમજાવ્યું. સાહેબશ્રી વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂર્વક આ કોર્ષમાં જોડાવવા બદલ તથા તેને સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ ખૂબ અભિનંદન પાઠવ્યા. વર્ષ ૨૦૧૫ માં કુલ ૨૦ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં છે, જેમાં ૧૮ વિદ્યાર્થી અને ૦૨ વિદ્યાર્થીનીઓ નો સમાવેશ થાય છે.

શ્રી હાર્દિક શર્મા, મદદનીશ પ્રાધ્યાપક દ્વારા કાર્યક્રમના સૂત્ર સંચાલન કરવામાં આવ્યું તથા સર્વ મહાનુભાવોનો કોલેજ વતી આભાર માનવામાં આવ્યો. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રી આર.સી.

સાળુંબે, મદદનીશ પ્રાધ્યાપક તથા ઇન્ચાર્જ, વોકેશનલ કોર્ષ અને શ્રી નીરવ એમ. સોલંકી, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, ફ.ઈ.ટે.કો, ગોધરા દ્વારા વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યા.

